



## પ્રકરણ - ૫

## કિશોરીઓની આરોગ્ય સમસ્યાઓ



### વિષયસૂચિ :

- |  |                                |
|--|--------------------------------|
| ૧.૦ તંદુરસ્ત વિકાસ માટે ખોરાક            | ૪.૦ બળજબરીથી કેવી રીતે બચશો.   |
| ૨.૦ કિશોરી અવસ્થામાં થતા શારીરિક ફેરફારો | ૪.૧ કોટુંબિક સભ્ય તરફથી બળજબરી |
| ૨.૧ માસિક રક્તસ્ત્રાવ                    | ૪.૨ દેહવિકય                    |
| ૨.૨ માસિક રક્તસ્ત્રાવ દરમ્યાન કાળજી      | ૪.૩ વણાઈરછીત સગર્ભાવસ્થા       |
| <b>૩.૦ સારા જીવન માટે જરૂરી પરિવર્તન</b> | ૫.૦ પરિવર્તન માટે પ્રયાસ       |
| ૩.૧ સારા ભાવિ માટેના નિર્ણયો કરવા        |                                |
| ૩.૨ પુરુષ સાથી અને સંભોગ વિશે નિર્ણય     |                                |
| ❖ સંભોગ વિશે સામાન્ય માહિતી              |                                |
| ❖ સંભોગ વગરની દોષ્ટી                     |                                |

## કિશોરીઓની આરોગ્ય સમસ્યાઓ

દરેક ખીના જીવનમાં ૧૦ થી ૧૫ વર્ષની ઉંમર એક સંકલણકાળ છે. આ સમયે તેના જીવનમાં જે પણ શારીરિક, માનસિક અને સામાજિક સંલેગો હોય તે પ્રમાણે તેનું ભવિષ્યનું જીવન અને માનસિકતા ઘડાય છે. તેથી કિશોરીઅવસ્થાના નાજુક સમયમાં તેને જેટલી સારી કાળજી મળે તેટલી તે મોટપણે વધુ તંહુરસ્ત બને છે. જે તેને સમજમાં આવકાર મળે, કુટુંબ જીવન આનંદીત હોય તો આ છોકરી તેના જીવનમાં હકારાત્મક વલણો ઘરાવશે. પણ જે તેની લાગણીઓનો સારો પ્રતિભાવ ના મળે તો માનસિક વિકાસ ઝંધાય છે. તેની પ્રતિભા ઓળ્હપાય છે અને તે સતત લઘુતાંથિથી પીડાતી હોય તેવી લાગે છે. જીવનમાં ઉત્સાહનો અભાવ તેને નકારાત્મક વલણો અપનાવવા પ્રેરે છે. આમ ૧૦-૧૫ વર્ષનો ગાળો સંવેદનશીલતાની દાસ્તાવેજ ખૂબ મહત્વનો ગાળો છે.



સ્વાસ્થ્યની પરિભાષામાં આપણે માનસિકતા પર ભાર મૂકવા છતાં અહીં સામાન્ય ચર્ચામાં શરીરના ભૌતિક સ્વાસ્થ્યની ચર્ચા વધુ કરીશું. ખાસ કરીને શરીરને વેઠવી પડતી નાની-મોટી પીડાઓ, દર્દો, રોગ વગેરેની અસર તેની જુંદગી પર જેવા મળે જ છે. માટે આવો, આપણે ભૌતિક સ્વાસ્થ્યની વાત વિશે સમજી લઈએ. આ સમયે છોકરી કિશોરીમાંથી પુષ્ટ ઉંમરની સ્ત્રી બનવા તરફ ડગ માંડે છે. તેના શરીરમાં નાનામોટા ફેરફારો થાય છે. આ ફેરફારોને લીધે તે મનમાં મુંજાય છે. આ ફેરફારો વિશે તેની માતા કે મિત્રો તરફથી કોઈ માહિતી મળતી નથી. આ પ્રકરણમાં આ મુંજારાને ટાળવા શરીરમાં થતા ફેરફારો તથા તકલીફો વિશે જાણકારી આપી છે. આ માહિતી કિશોરીઓને આ પ્રશ્નો અંગે સાચો નિર્ણય લેવામાં મદદદૃપ થશે.

### ૧.૦ તંહુરસ્ત વિકાસ માટે ખોરાક :

કિશોરીઅવસ્થામાં વિશેષ શારીરિક વિકાસ અને વૃદ્ધિ થાય છે. આ માટે આ સમયગાળામાં પૂરતું અને યોગ્ય પોષણ મળી રહે તે જરૂરી છે. પૂરતો અને યોગ્ય ખોરાક અનેક રીતે લાભપ્રદ નીવડે છે. દા.ત. શાળા શિક્ષણમાં સફળતા, ભાવિ પ્રસૂતિમાં સલામતી અને વૃદ્ધાવસ્થામાં ઓછી મુશ્કેલીઓ પડે. આ માટે છોકરીઓને છોકરાઓ જેટલો જ ખોરાક મળવો જોઈએ. તેમને ખોરાકમાં કઠોળ, ફળ, શાકભાજ વગેરે મળવાં જોઈએ. આપણા દેશમાં છોકરાઓ અને છોકરીઓના ઉછેરમાં ભેદભાવ જેવા મળે છે.




તે બરાબર નથી. છોકરીઓની શારીરિક જરૂરિયાતો માટે તેમને છોકરાઓ જેટલો જ કે તેથી વધુ ખોરાક મળવો જરૂરી છે. છોકરીઓને દર મહિને આવતા માસિકમાં ઘણું લોહી વહી જય છે. તેનાથી તેમને લોહતત્ત્વની ખામી થાય છે. વળી, આ વર્ષોમાં તેઓ ઘણી નવી નવી પ્રવૃત્તિઓમાં ભાગ લે છે. શારીરિક શ્રમના કામો વધે છે. આ બધા કારણોસર તેમને વધુ ખોરાક મળવો જેઠાએ. તેમના ખોરાકમાં વધુ પ્રમાણમાં શાકભાજુ, કઠોળ, તેલ-ધી વગેરે હોવા જેઠાએ. વળી, વિકસતા હાડકાં માટે તેઓને કેલ્વિયમની ખાસ જરૂર પડે છે. મોટી ઉંમરે કેલ્વિયમના અભાવે હાડકાં પોચાં થવાની ફરિયાદ ઓછી થાય તે માટે અત્યારથી તેમને કેલ્વિયમવાળો ખોરાક (દૂધ, દહીં, વગેરે) મળવો જેઠાએ.

## ૨.૦ કિશોરી અવસ્થામાં થતા શારીરિક ફેરફારો :

જુદી જુદી છોકરીઓમાં આ ફેરફારો જુદા જુદા સમયે-ઉંમરે થાય છે. ૧૦-૧૭ વર્ષની ઉંમરમાં ગમે ત્યારે ફેરફારો શરૂ થતા જેવા મળે છે. આ કુદરતી છે. તમારા શરીરમાં થતા ફેરફારો તમારી બહેન કે બહેનપણી કરતાં વહેલા કે મોઢા શરૂ થાય તો ચિંતા કરવી નહિ. આ ફેરફારો નીચે વર્ણવ્યા છે.

આ સમયમાં તમારી ઉંચાઈ વધવાની શરૂઆત થાય છે. માસિક શરૂ થયા પછી ૧ થી ૩ વર્ષ સુધી ઉંચાઈ વધતી રહે છે. ઉંચાઈ વધવાની સાથે સાથે શરીરના અંદરના અંગોમાં ફેરફાર તેમજ વિકાસ થાય છે, જે વિશે બહારથી ખબર પડતી નથી. આ ફેરફારો અંતઃખાવોના કારણે થાય છે. ગર્ભાશય, બીજાશય તથા યોનિ મોટા થાય છે. હવે છોકરી શારીરિક રીતે સ્ત્રી બનવાની છે. તેથી તેના પ્રજનનઅંગોનો વિકાસ પૂર્ણ થાય છે.



- \* ઉંચાઈ વધે છે અને શરીર સુડોળ બને છે.
- \* મોં ઉપર ચિકાશ આવે છે. કોઇક વખત ખીલ થાય છે.
- \* વધુ પરસેવો થાય છે.
- \* બગલમાં અને યોનિ ઉપર વાળ ઉગે છે.
- \* સ્તનની વૃદ્ધિ થાય છે. શરૂઆતમાં એકબાજુનું સ્તન બીજી સ્તન કરતાં વધુ જરૂરથી વધે છે. પરંતુ સમય જતાં બંને સ્તન સરખાં મોટાં થાય છે.
- \* યોનિમાર્ગ ભીનો થવાનું શરૂ થાય છે.
- \* માસિક રક્તખ્રાવ શરૂ થાય છે.

આ ફેરફારોની સાથે સાથે માનસિક ફેરફારોનો પણ અનુભવ થાય છે. સરખી ઉંમરના છોકરાઓ સાથે હળવા મળવાની દ્રચ્છા થાય છે. કોઇક વખતે વધુ પડતો ગુસ્સો, આનંદ કે ચિંતાની લાગણીઓ થાય છે.


## કિશોરીઓની આરોગ્ય સમસ્યાઓ

### ૨.૧ માસિક રક્તસ્વાવ (દર મહિને યોનિમાર્ગ લોહી વહેવું) :

માસિક રક્તસ્વાવ શરૂ થાય ત્યારે ગાભરાનું નહિ કે ચિંતા કરવી નહિ. એના માટે ગૌરવની લાગણી અનુભવવી જોઈએ. માસિક રક્તસ્વાવ ગંદો કે શરમજનક છે તેવું બિલ્કુલ માનશો નહિ. માસિકની શરૂઆત એ સૂચવે છે કે જે તમે કોઈ પુરુષ સાથે શારીરિક સંબંધ કરો તો તમે સગર્ભા બની શકો છો. સામાન્ય રીતે સ્તન મોટા થાય, યોનિ ઉપર વાળ ઉગે તથા યોનિમાર્ગ બીનો થવા માંડે તેના કેટલાક મહિના પછી પહેલું માસિક આવે છે.

માસિક વખતે નીકળતા લોહીને જીલવા બજારમાં ભળતા પેડ કે ઘરમાંથી

જીણા ચોળાયા, સુતરાઉ કાપડની ઘડી કરીને વાપરી શકાય છે.



કપડું ભીનું થઈ જય પછી તેને સાબુ અને ખૂબ પાણીથી ધોઈ કાઢો અને તડકે સૂકવો.

માસિક પેડ ભીનું થઈ જય પછી તેને ફેંકી દેવાનું હોય છે. પરંતુ આખું એમને એમ ફેંકી દેવાથી કચરાપેટીમાં વાસ આવે છે, ફૂતરા કે ભૂંડ જેવા પ્રાણીઓ તેને ફેંકીને અહીં તહીં ઝેંચી જય છે અને આ પેડ શેરીઓમાં અહીંતહી રખડતા દેખાય છે. તેને બદલે આ પેડમાંથી નીચેનું પ્લાસ્ટિક હોય તો તે દૂર કરો અને અલગ ફેંકી દો. બાકીના ડા-કાપડને ખૂબ પાણીમાં નાંખી બે-ત્રણ વાર નિયોગીને મુઢીમાં દૂચો વાળી કચરાપેટીમાં ફેંકી દો. શહેરમાં સંડાસના પાઠપમાં તેને નાંખવાથી પાઠપ ભરાઈ જય છે અને તેને કારણે બીજુ મુશ્કેલીઓ પડે છે.

**૨.૨ માસિક રક્તસ્વાવ દરમ્યાન કાળજી :** માસિક સમયે આવતા લોહીથી કપડાં તથા પગ(જંધ) ભીના થાય છે. વહેતા લોહીને ચૂસી લેવા માટે ઘણી બેનો જુનાં કપડાંની ગડી કરીને ગાહી (પેડ) બનાવી યોનિ ઉપર મૂકી રાખે છે. આ ગડી કરેલ કપડાને રબર, દોરી, પાટથી કે પીનથી બાંધી શકાય છે. પીન વાગી ના જય તેનું ધ્યાન રાખો. આ કપડાને કે પેડને દિવસમાં બે-ત્રણવાર બદલવું જોઈએ. કપડું ફરી વાપરવાનું હોય તો તેને સાબુથી બરાબર ધોઈને તડકે સૂકવ્યા પછી જ વાપરવું. આમ કરવાથી યોનિમાર્ગમાં કે ગર્ભાશયમાં જીવાણું જતા અટકે છે. આવી સફ્ફાઈ ન રાખવાથી શરીર ધોવાવાનો (શૈતપ્રદર) રોગ થાય છે. પગ ઉપર કે યોનિ પર લાગેતા લોહીને સાબુ અને પાણીથી રોજ બે વાર ધોવા જોઈએ. આ સમય દરમ્યાન રોજિંદા કામ બંધ કરવાની જરૂર નથી. છતાં વધારે પડતા શ્રમના કામો કરવા જોઈએ નહિ.



માસિક દરમ્યાન સારી રીતે દિવસમાં બે વાર નહાવું. પરંતુ તળાવ કે નહીમાં નહાવા ન પડવું. તેનાથી અંદરનો ચેપ થઈ શકે છે. માટે ઘરે જ પૂરતું પાણી અને સાબુ લઈ નહાવું જોઈએ.



### ૩.૦ સારા જીવન માટે જરૂરી પરિવર્તન :

સામાન્ય રીતે તમારા માટે જેવું વિચારો તેવા તમે બનો છો. સાથે સાથે સમાજ, કુટુંબ તમારા માટે જે વિચારે છે તેવા તમે બનો છો. મોટા ભાગનો સમાજ સ્ત્રીઓને નીચ્યાલા દરજાની ગણે છે. સમાજમાં છોકરીઓ છોકરાઓ કરતાં ઓછી મહત્વની છે તેમ મનાય છે. છોકરીઓને નાનપણથી આ પ્રમાણે શીખવાડાય છે. તેમને તેમના શરીરની શરમ સાથે સ્ત્રીન્ય પુરુષત્વ કરતાં નીચું છે, તેમને ભણતરની જરૂર નથી, નવી નવી કુશળતા કેળવવાની તેને જરૂર નથી તેમ છસાવવામાં આવે છે, જે છોકરીઓને વધુ ભણાવવામાં આવે છે તેમને પણ એ સમજવવામાં આવે છે કે, “ભણવાથી સારો વર મળશો, અંતે તો તમારે ઘર, વર અને બાળકો સંભાળીને ઘરમાં જ રહેવાનું છે !” માટે છોકરીઓએ વિનન્દત્તા અને સહનશીલતાના ગુણ કેળવી પુરુષ અને સાસરીયાંને જળવવા તે એક જ અંતિમ લક્ષ રાખવું જરૂરી છે. તેમને છેલ્લું અને ઓછું ખાવાનું છે, છોકરા કરતાં વધારે કામ-ફ્સરડો કરવાનો છે, અપમાન સહન કરવાનું છે, તેમ રોજિંદા વ્યવહારમાં છતું થાય છે. આવા સમાજમાં સ્પષ્ટ છે કે સ્ત્રીને નીચું સ્થાન મળો. પરંતુ જે આનાથી ઉલ્લંઘ, સમાજ અને કુટુંબ છોકરીને છોકરા-સરખું સ્થાન આપો, તેવો રોજિંદો વ્યવહાર કરે તો સ્ત્રીનું જીવન સરળ બને છે. તૈના કારણે સ્ત્રીનું કૌટ્યંબિક સ્થાન તથા સામાજિક જીવન, સુખી અને સમૃદ્ધ બને છે. આવા સમાજ પ્રગતિ કરે છે.

છોકરીઓના ઉત્થાન માટે કેટલાક વિચારો/પગલાં આ પ્રમાણે હોઈ શકે. પોતાના ઘરથી શરૂ કરો

- \* તમારા ઘરમાં વહુ, દીકરી કે બેનને મહિના રહે ત્યારે ગર્ભજનિતિ પરિકાણ ના કરાવશો. સ્ત્રીગર્ભ હોય તો કહી પડાવશો નહિ.
- \* તમારી દીકરીને અને દીકરાને સરખું ભણાવો, સરખું માન આપો, તેમની સાથે સરખો વ્યવહાર રાખો.
- \* રમત-ગમતમાં સરખું પ્રોત્સાહન મળે તેવું ગોઠવો. ઘરમાં અને બહાર તેમને સમાન તકો મળે તેનું દ્યાન રાખો.
- \* તે એક છોકરી છે માટે તેને પઢતી મુશ્કેલીઓ શાંતિથી સાંભળો અને નિવારો.
- \* તમે પોતે છોકરી હોવાનું ગૌરવ રાખો. જે તેમને સમજે અને સાંભળે તેવા કોઈકની સામે (મિત્ર, બેન, કોઈક સ્ત્રીસંબંધી) તમારી બીક, પ્રક્ષો, સ્વભનોની વાત કરો.
- \* તમારા મિત્રો સાથે મળીને સમાજને ઉપયોગી કોઈક કામ કરો. આથી તમારો ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશો. બીજા લોકો પણ તેમને માનની દસ્તિથી જેવા લાગશો.

## કિશોરીઓની આરોગ્ય સમસ્યાઓ

૩.૧ સારા ભાવિ માટે તમે તમારા કુટુંબ સાથે મળીને કેટલાક નિર્ણયો કરો, જેમકે :

તમારા ભાવિનું આયોજન જતે કરો :

તમારા જીવનનું કોઈ ધ્યેય નક્કી કરો. તમે શું કરવા ધારો છો-શું થવા છચ્છો છો તે નક્કી કરો. આ વાત કોઈક સંવેદનશીલ વ્યક્તિ આગળ વ્યક્ત કરો અને આગળ વધવા પ્રયત્ન કરો. મુશ્કેલી પડશો પણ આત્મવિશ્વાસ રાખશો તો જરૂર તમે તમારું સ્થાન ઉચ્ચું લાવી શકશો.

**શિક્ષણ અને તાલીમ :** શિક્ષણના કારણે આત્મસંમાન વધે છે. તેનાથી સુખી અને સ્વસ્થ જીવનની દિશાઓ ઉધરે છે, માટે નિયમિત શાળાએ ભણવા જરૂર. જે શાળાનો અભ્યાસ ન થઈ શકે તો ઘરે કોઈની મદદથી ભણવાનો પ્રયત્ન કરવો. ભણવા ઉપરાંત બીજુ કુશળતાઓ પણ કોઈ કારીગર સાથે રહીને શીખી શકાય.

**લગ્નની ઉતાવળ ન કરો : જ્યાં સુધી તમે ભણી ના**

રહો તથા થોડું કામ કરીને અનુભવ ન મેળવો ત્યાં સુધી કુટુંબને કહો કે તમારા લગ્ન માટે ઉતાવળ ના કરે. માતા બનવાની ઉતાવળ ના કરો : લગ્ન પછી તમારું લગ્નજીવન સારી રીતે ગોઠવાય, તમે તથા તમારા પતિ બાળ-ઉછેરની જવાબદારી લેવા તૈયાર થાવ ત્યાં સુધી રાહ જુઓ. તમારા શિક્ષણ કે કામમાં બાળક પેઢા થવાથી ખલેલ ન પડે તે માટે બાળક યોગ્ય સમયે થાય તેની કાળજી રાખો. સાથે સાથે તમારું શરીર, પ્રજનન તંત્ર, સગર્ભવસ્થા, પ્રસૂતિ, બાળઉછેર અને જાતીય રોગો વિશે માહિતગાર બનો.

૩.૨ પુરુષ સાથી અને સંભોગ વિશે કેવી રીતે નિર્ણય કરશો.

તરણ ઉંમરે છોકરાઓને અને છોકરીઓને એકબીજનો સ્પર્શ ગમે છે. તે માટે તે પ્રયત્ન પણ કરે છે. છતાં આપણા સમાજના ડાફિરિવાજ જેતાં છોકરીઓને આ અંગે વધુ વિચારવું પડે છે. છોકરીઓએ પસંદ કરવાનું છે કે આ તેનો માટે યોગ્ય છે ? આ પુરુષ ફક્ત આનંદ ખાતર જ તેનો ઉપયોગ કરવા માંગે છે ? કે તે જવાબદારી પૂર્વક સંબંધ નિભાવવા માંગે છે ? તેનો સમાજ અને કુટુંબ આ સંબંધ



સ્વીકારશે ? જે ન સ્વીકારાય તો તેઓ શું કરશે ? પુષ્ટ ઉમરે પહેંચેલ છોકરા-છોકરીઓને પોતાની રીતે સંભોગ સંબંધ કે મૈત્રી રાખવાનો અધિકાર હોવા છતાં શારીરિક સંબંધ બાંધતાં પહેલા ખૂબ જ ગંભીરતાથી નિર્ણય લેવો જેઠાં. જે તેમ કરવાનું તમે નક્કી કરો તો લગ્ન પહેલાં શારીરિક સંબંધથી બાળક ન થાય કે જાતીય રોગ ન થાય તે માટે જરૂરી સાધન વાપરવાં જેઠાં. જે પુરુષ તમને પૂરતા સન્માનથી ના જેતો હોય કે જેના વિચારો સ્વી-પુરુષ સમાનતાના ન હોય તેની સાથે તમારી મિત્રતા અંગે તમારે પોતે નિર્ણય કરવાનો રહે છે.

#### સંભોગ વિશે સામાન્ય માહિતી :

સંભોગમાં સ્વીની યોનિમાં પુરુષનું શિક્ષ મૂકાય અને ત્યાર બાદ અધૂરો કે પૂરો વીર્યપાત થાય છે.



સંભોગ કરવાથી ગર્ભ-મહિના રહી શકે છે.

સંભોગ વખતે પુરુષનું પૂરેપૂરું વીર્ય સ્ખલન ના થયું હોય તો પણ ગર્ભ રહી શકે છે.

ગર્ભનિરોધની પદ્ધતિ વાપર્યા વગર સંભોગ કરવાથી ગર્ભ રહી શકે છે.

જાતીય રોગવાળી વ્યક્તિ સાથે સંભોગ દરમ્યાન નિરોધ ન વાપરો તો ગંભીર જાતીય રોગ કે એઠિડ્સનો ચેપ લાગે છે.

તંદુરસ્ત હેખાતી વ્યક્તિને પણ જાતીય રોગ હોઈ શકે છે.

#### સંભોગ વગરની દોસ્તી :




સાચો પ્રેમ અને મૈત્રી એકદમ કેળવાતા નથી તેમાં સમય લાગે છે. એક બીજી માટે કાળજી, આદર, વિશ્વાસ અને જવાબદારીની ભાવના હોય તે જ પ્રેમબધ્યો સંબંધ છે તેમ કહેવાય. પ્રેમ બતાવવા માટે સંભોગની જરૂર નથી. સંભોગ કર્યા સિવાય એકબીજાની નજીક આવવા, સાથે સમય ગાળો, એકબીજાના અનુભવો, જીવનદશ્ટિ, સ્વપ્નોની આપ લે કરો. તમે કેવું જીવન જીવવા માંગો છો, કેવા સાથી કે બાળકો ઈચ્છો છો તેની ચર્ચા કરો. એકબીજાનો સ્પર્શ આનંદદાયક હોય છે. પણ સ્પર્શમાંથી સંભોગ સુધી ન પહેંચી જવાય તેની કાળજી રાખો. કારણકે, પુષ્ટ ઉમરના વ્યક્તિઓનો અધિકાર હોવા છતાં આપણો સમાજ લગ્ન કર્યા સિવાયના સંભોગને માન નથી આપતો.

## કિશોરીઓની આરોગ્ય સમસ્યાઓ

### ૪.૦ બળજબરીથી કે ફોસલાવીને કરતા સંભોગથી કેવીરીતે બચશો :

પુરુષ મિત્ર તરફથી બળજબરી : આજા જગતમાં છોકરીઓ અને સ્ત્રીઓ સાથે જબરદસ્તીથી સંભોગના બનાવો બને છે. ધારી વખત પુરુષમિત્ર છોકરીઓની લાગણીઓને ઉશ્કેરીને, પ્રેમના નામે દૃબાણ કરીને કે બીજી રીતે ફોસલાવીને છોકરી ઉપર સંભોગ માટે દૃબાણ કરે છે. આ બરોબર નથી. આવી પરિસ્થિતિ ઉભી ન થાય તે માટે નીચે પ્રમાણે સાવચેતી રાખો :

- \* કોઈ પણ પ્રકારની બળજબરી થાય તો પોતાનો બચાવ કેવી રીતે કરશો તેની તાલીમ લો.
- \* પુરુષ મિત્રને સ્પષ્ટ ‘ના’ કહો. સાથે સાથે તેને શારીરિક રીતે પણ રોકો.
- \* પુરુષમિત્રની લાગણીઓ, આજીજ કે દૃબાણને વશ ન થશો. તેને સમજનો કે એની લાગણી અને આવેગોને તમે સમજુશ છો. પણ તમે સંભોગ ઈચ્છાતાં નથી.
- \* જે તમને અડકવાનો પ્રયત્ન કરે અને તમને ના ગમે અથવા એમ લાગે કે સ્પર્શ ધ્વારા તમારો પુરુષ મિત્ર સંભોગની માંગણી મૂક્શો તો તે સ્થળેથી ચાલ્યા જાવ. મોટે મોટેથી વાત કરો, મોટા અવાજે વિરોધ કરો અને જરૂર પડે ભાગી જાવ.
- \* દાડું કે નશાકારક પદાર્થ ન લો. તેમ કરવાથી તમે તમારી જત ઉપરનો કાબૂ ગુમાવી બેસશો અને પુરુષમિત્રની ઈચ્છાને વશ થઈ જશો.
- \* પુરુષ મિત્ર સાથે અજાણી અને એકાંત જગ્યાએ ન જાવ. બને ત્યાં સુધી સમૂહમાં જ રહો. બીજ સ્ત્રીમિત્રો અને પુરુષમિત્રો સાથે હોય તેની કાળજી રાખો.



૪.૧ કૌટુંબિક સભ્ય તરફથી બળજબરી : ધારી વખત ભાઈ, પિત્રાઈ ભાઈ, કાકા, મામા કે પિતા તરફથી પણ સંભોગ માટે દૃબાણ કે બળપ્રયોગ થાય છે. કોઈપણ વ્યક્તિ તમારા સ્તન કે ગુપ્ત અંગોને અડકે તો તેનાથી ચેતતા રહેવું. કોઈ ધમકી આપે તો તેને વશ થવું નહિ. આ અંગે માતાને કે બીજ વિશ્વાસપાત્ર વ્યક્તિને વાત કરો. ઘરના અન્ય વડીલોને પણ જરૂર પડ્યે વાત કરવી અને તે પુરુષને ઠપકો અપાવી શકાય. તેની સાથે એકલા ઘરમાં કઢી ના રહેશો.



ધારીવાર મોટી ઉમરના પુરુષો તરફ છોકરીઓ આકર્ષાય છે. સમાજમાં પ્રભાવશાળી, વગદાર પૈસાદાર પુરુષના મોહમાં છોકરીઓ આવી જય છે. આવા પુરુષો છોકરીઓને બેટસોગાદ આપીને ફોસલાવે છે. મોટી ઉમરના પુરુષો છોકરીઓને સંભોગ માટે મજબૂર કરે છે. છોકરીઓએ આવા પુરુષો અંગે બેનપણી કે માબાપને વાત કરવી જેઠાંએ.

૪.૨ દેહવિક્ષય : ઘણીવાર ગરીબીના કારણે માબાપ દીકરીને ઘરડા પુરુષ સાથે પરણાવી હે છે. કોઈક વાર દીકરીને વેચી હે છે. સ્ત્રીઓને વેચવાનો ધંધો કરતા દસાલો છોકરીઓને શહેરમાં નોકરી આપવાની લાલચે લઈ જય છે અને આ છોકરીઓને વેચી હે છે કે ગણિકાનો ધંધો કરવે છે. આવા સંનેગોમાં શિક્ષિકા, કે બીજા સંબંધીઓને જાણ કરી તેમની મદદ મેળવો.



૪.૩ વણાઈછીત સગર્ભાવસ્થા : જે નિયમિત આવતું માસિક મોડું આવે, સ્તનમાં ભરાવો લાગે, ઉબડા આવે અને તમારે કોઈ પુરુષ સાથે સંબંધ થયો હોય તો કદાચ મહિના રહ્યા છે. આ માટે દાક્તરી તપાસ કરાવો. જે મહિના રહ્યા હોય અને બાળક ન જેઠિતું હોય તો દાક્તરી સલાહ લો. આણઘડ રીતે ગર્ભપાત ન કરાવો. તેમાં જીવને જેખમ છે. ગર્ભપાત સલામત રીતે થઈ શકે છે. તેને માટે આ જ પુસ્તકમાં અન્યત્ર આપેલી માહિતી જરૂર વાંચો. આવેલી આપ્તિનો ધીરજપૂર્વક વિચાર કરી સામનો કરો. રડીને કે હતાશ થઈને બેસી રહેશો તો પરિસ્થિતિ વધુ મુશ્કેલ બનશો. આવી પરિસ્થિતિમાં સ્ત્રીરોગ નિષ્ણાતની મદદ તમને ગંભીર જેખમભાંથી બચાવી શકશો.



૫.૦ પરિવર્તન માટે પ્રયાસ : જેમ જેમ સમાજમાં શિક્ષણ વધતું જય છે તેમ તેમ કિશોરવયે જ કંઈ કરી દેખાડવાની કે શરીર સાથે પ્રયોગો કરવાની ઈચ્છા થાય છે. ઘણીવાર છોકરાઓના મનમાં પોતાની ઓળખાણવાળી છોકરી પોતાનો પ્રેમ/માંગણીના સ્વીકારે તો તેની પ્રત્યે હિંસાત્મક વલણ અપનાવવાનું દૃબાણ વધતું જય છે. આ માટે જલ્દી માધ્યમો અને બદલાતા મૂલ્યો જવાબદાર હોવા છતાં આ સમસ્યા

## કિશોરીઓની આરોગ્ય સમસ્યાઓ

અંગે દૂરેક સ્તરે જગૃતિ આણવી અને તે પ્રકારના શૈક્ષણિક કાર્યક્રમો યોજવા જરૂરી છે.

તમે શાળામાં કોલેજમાં કે સંસ્થામાં અવનવા મેળાવડાઓમાં કિશોરવયના પ્રશ્નોની ચર્ચા વિચારણા કરો જેથી આજના કિશોર-કિશોરી આવતીકાળના જુવાન નાગરિકો બને ત્યારે વધુ જવાબદીર રીતે વર્તન કરી શકે. સ્વાસ્થ્યની દસ્તિએ જાતીય રોગ અટકાવવા, ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ વધારવું અને દીકરા-દીકરીને એક સમાન ગણી સારી રીતે ઉછેરવા તે મહત્વનું છે. માટે તમે જ્યાં છો ત્યાંથી તે ભાબતના પ્રયત્નો શરૂ કરી હો એ મહત્વનું છે.



કન્યા-શિક્ષણ સ્વીસ્વાસ્થ્યની સમસ્યાઓ ઉકેલવા માટે જરૂરી જગૃતિ લાવવામાં અગત્યનો ભાગ ભજવે છે.